

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૧૨/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૪૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૩ કેસ કરી, ૦૮ વ્યક્તિઓને ઝડપી, ૯૪ લીટર દેશી દારૂ, ૧૪૪ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૦૧ એક્ટીવા કબજે કર્યું હતું.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૪૩/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ હેઠળ ૩૭ વ્યક્તિઓને અને પાસા મુજબ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

પર્સ ઝુંટવી લઈ ગયો :-

સમાચાર યાદી નં.૨૫૪૪/૧૭

નારણપુરા : અમીતાબેન વા/ઓ વિરેનકુમાર મિસ્ત્રી (ઉ.વ.૪૦)(રહે,રાજેશ્વરી સોસાયટી નીશાન સ્કુલની સામે રાણીપ) તા.૧૮/૧૨/૧૭ બપોરના ૦૩/૧૫ વાગ્યાના સુમારે હેવમોર આઈસ્ક્રીમ સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક એક્ટીવા નંબર જીજી-૧-એન.એફ-૨૯૨૪ ઉપર આવેલ પુરૂષ (૨૦ થી ૨૫ વર્ષના આશરાનો) અમીતાબેનની નજીક એક્ટીવા ચલાવી લાવી, અમીતાબેનનાં હાથમાંથી પર્સ કે જેમાં રોકડા રૂપિયા ૨૦,૦૦૦/- તથા સેમસંગ એસ-૭ મોડલનો મોબાઇલ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૫,૦૦૦/- મતા ભરેલ પર્સ ખેંચી લઈ ગયો છે. આ ગુનાની ફરીયાદ અમીતાબેને નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી ભુપતસિંહ ચંદનસિંહચલાવે છે.

ખુલ્લા મકાનમાંથી ચોરી :-

સમાચાર યાદી નં.૨૫૪૫/૧૭

પાલડી : અલતાફભાઈ મંહમદહુસેન ગાંધી (ઉ.વ.૫૫)(રહે,કૈજમંહમદ સોસાયટી અલીફ ફ્લેટની સામે મહાલક્ષ્મી પાંચ રસ્તા પાલડી) એ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૧૨/૧૭ રાતના ૧૧/૩૦ થી તા.૧૮/૧૨/૧૭ ના કલાક ૭/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતાના ખુલ્લા ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, ઘરમાંથી કુલ-૪૭ તોલા વજનના સોના-ચાંદીના દાગીના કુલ કિંમત રૂપિયા ૯,૪૪,૫૦૦/- મતાના ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.સિન્ધી ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૨૫૪૬/૧૭

સાબરમતી : કમલેશભાઈ કસ્તુરભાઈ પટણી (રહે,કૈલાસનગર ભીલવાસ સાબરમતી) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૧૨/૧૭ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે અચેર ડેપોની સામે આવેલ ઓ.એન.જી.સી. ના કોટ પાસે પોતાની મહેન્દ્ર બોલેરો પીકઅપ ડાલુ આર.ટી.ઓ નંબર જીજે-૦૧-ડી.ઝેડ-૬૩૪૯ કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી જેની ચોરી તા.૧૫/૧૨/૧૭ સવારના ૯/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ ગુનાની તપાસ હે.કો.શ્રી દિનેશભાઈ મંગુભાઈ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૫૪૭/૧૭

શહેરકોટડા : વિજયકુમાર કજોડમલ કુમાવત (ઉ.વ.૨૫)(રહે,શાયોના રેસીડન્સી નવી ફોજદારની ચાલી પાસે, હિરાવાડી બાપુનગર) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૧૨/૧૭ ના કલાક ૧૨/૧૫ વાગ્યાના સુમારે મેમ્કો ચાર રસ્તા પાસે, સી.એન.જી.પંપ પાસે રોડ ઉપર પોતાના મોટર સાયકલ ઉપર પોતાના મિત્ર રામચંદ્ર ડિંડોર ને બેસાડી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક અજાણ્યો ઓટોરિક્ષા ચાલકે પોતાના કબજાની રીક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી, મોટર સાયકલ ને ટક્કર મારતા પડી જતા, વિજયકુમારને શરીરે ઇજાઓ થઈ હતી તેમજ રામચંદ્ર ડિંડોર નું મૃત્યુનિપજ્યુ હતું. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.આઇ.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૫૪૮/૧૭

ઘાટલોડીયા : સાગર યોગેશભાઈ ત્રીપાઠી (ઉ.વ.૨૧)(રહે,ગીરીરાજ સોસાયટી, વિભાગ-૨ ઇશ્વરકાકા નગર પાસે કે.કે.નગર રોડ ઘાટલોડીયા) પોતે નોકરી કરવા માંગતો હોય અને તેના પિતા નોકરી કરવાની ના પાડતા હોય જે બાબતે મનમાં લાગી આવતાં તા.૧૮/૧૨/૧૭ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુક સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કમલેશભાઈ કાળાભાઈ ચલાવે છે.

નવા વાડજ : મોનીકા દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.૨૦)(રહે,આંબેડકરની ચાલી બેંક ઓફ બરોડા સામે રામાપીરનો ટેકરો નવાવાડજ) એ કોઈ અગમ્ય કારણોસર તા.૧૮/૧૨/૧૭ ના કલાક ૧૧/૦૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે નવા વાડજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એ.પી.પરમાર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.